

રાજકોટ રૂરલ જિલ્લા :- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- નવેમ્બર/૨૦૧૯

ચીલઝડપ

- (૧) તા.૦૪/૧૧/૨૦૧૯ ના રોજ ફરીયાદીશ્રી હરેશભાઈ ડોસાલાલ યાવડા જાતે.દરજી ઉ.વ.૬૦ ધંધો.નિવૃત્ત રહે.ગોંડલ, ભવનાથ-૨, પવનચકકી સામે મધુરમ વાળાએ ગોંડલ તાલુકા પો.સ્ટે.માં પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, પોતે તથા પોતાના પત્ની બન્ને વિરપુર જલારામ મંદીરે દર્શન કરી પોતાનું જ્યુપીટર મોટર સાયકલ લઈ પરત ગોંડલ આવતા હતા તે વખતે બપોરના દોઢેક વાગ્યે ચોરડી ગામથી થોડે આગળ આવતા પાછળથી એક સ્પ્લેન્ડર મોટર સાયકલ ત્રણ સવારીમાં આવેલ અને મો.સા. બાજુમા ચલાવી પાછળ બેઠેલ ઇસમે પોતાના પત્નીના ગળામાં પહેરેલ સોનનો ચેઇન ૨૩.૬૩૦ મીલી ગ્રામનો કિ.રૂ. ૫૪,૮૫૦/- નો જોટ મારી તોડી લઈ ચીલ ઝડપ કરી, નાશી ગયેલ છે. તેવી ફરીયાદ જાહેર કરતા, ગોંડલ તાલુકા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૬૨/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૭૯(એ)(૩), ૧૧૪ મુજબ ગુન્હો નોંધાયેલ હતો. જે ગુન્હો વણશોધાયેલ હોય અને તા.૦૮/૧૧/૨૦૧૯ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારના રીબડા ગામ પાસે અરડોઇ લોધીકા તરફ જવાની ચોકડી પાસેથી (૧) જીતેશ ઉર્ફે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે જીત્યો વલ્લભભાઈ રાહોડ જાતે.દેવીપુજક ઉ.વ.૨૮ રહે.રાજકોટ યુનારાવાડ કુબલીયા પરા શેરી નં.૫ ચંદ્રીકા પાનની સામે તથા (૨) લખન બચુભાઈ માલાણી જાતે.સલાટ ઉ.વ.૨૩ રહે.રાજકોટ યુનારાવાડ શેરી નં.૧/૧૪ કૈલાશ પાન સામે વાળાઓને ગુન્હામા વાપરેલ હિરો સ્પ્લેન્ડર મો.સા. નંબર વગરનું જેના એન્જીન નં. HA10ACK5H02963 તથા ચેચીસ નં. MBLHAW095K5H02042 વાળુ કિ.રૂ. ૫૦,૦૦૦/- તથા રેડમી કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫,૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૧,૦૦૦/- મળી કુલ રૂ. ૫૬,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમોની પુછપરછ કરતા પોતે બન્ને તથા નં. (૧) જીતે ઉર્ફે જીત્યા નો દિકરો એમ ત્રણેય એ સામે મળી તા.૦૪/૧૧/૨૦૧૯ ના રોજ ચોરડી ગામ પાસેથી સોનાના ચેઇનની ચીલઝડપ કરેલ હતી અને તે ચેઇન આરતીબેન વિજયભાઈ મકવાણા રહે.લાખાજીરોડ ઉધોગનગર શેરી નં. ૫ વાળીને આપી તેના મારફત મુથુટ ફાયનાન્સ માંથી લોન લીધેલ છે તેવી હકિકત જણાવતા અને મળી મુદામાલ કબજે કરી, મજકુર બન્ને ઇસમોને ગોંડલ તાલુકા પો.સ્ટે.ના ઉપરોકત ગુન્હામાં સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી, આરોપીઓ તથા મુદામાલ ગોંડલ તાલુકા પો.સ્ટે. સોંપી આપી આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.
- (૨) ગોંડલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૮/૧૯ ઇ.પી.કો.ક.૩૭૯, ૧૧૪ વિગેરે મુજબનો ગુનો તા.૨૪/૧૦/૧૯ ના રોજ જાહેર થયેલ આ ગુનામાં રોકડા રૂ.૨,૨૨,૦૦૦/- ની ચોરી થયેલ આ વણ શોધાયેલ ગુનાની તપાસ દરમ્યાન આ કામનાં આરોપી (૧) રોસૈઆરા બાબુ વસંતેર ગોડેતી ઉ.વ.૫૪ (૨) મધુ ભાસ્કર જાલા ઉ.વ.૨૩ (૩) મકાલા અનીલ દાયકાર ઉ.વ.૩૫ જાતે ખ્રિસ્તી ધંધો મજુરી (૪) ચાલા ચંદ્રાણા વા/ઓ કોન્ડાઇદ ઉ.વ.૫૦ જાતે ખ્રિસ્તી ધંધો મજુરી રહે.કચારાણાતીયા ગામ ઇન્દીરા કોલોની તા.કાપાલી થાણા તીપા જી.નેલ્લો આંધ્ર વાળાને તા.૨/૧૨/૧૯ ક.૨૦/૧૫ વાગ્યે અટક કરી ગુનામાં ગયેલ રૂપીયા પૈકી રૂ.૧,૪૮,૬૦૦/- નો મુદામાલ કબજે કરી ગુનો ડીટેક્ટ કરેલ છે.